

રહેણાંક વિસ્તારોમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘુસી દાગીના અને રોકડ રકમ ચોરી કરતા ચોરને ઝડપી પાડતી, સુરત શહેર કાઇમ બ્રાંચ,

સુરત શહેર વિસ્તારમાં મિલકત સંબધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા શહેર વિસ્તારમાં ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ માણસોની ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ. શ્રી સી.આર.દેસાઇ નાઓની ટીમના માણસો હે.કો. મનોજ તુકારામ અને હે.કો. શૈલેષ રાઘેબિહારીનાઓને મળેલ બાતમી આધારે લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી આરોપી- સોનુસીંગ વિક્રમસીંગ સીકલીકર ઉ.વ. ૨૧ રહે. ૪૯, યોગીકૃપા સોસાયટી, છાપરાભાઠા રોડ અમરોલી, સુરત મુળ રહે. નંદુરબાર એકતાનગર તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર નાને પકડી પાડી તેના કબજામાંથી સોનાની બંગડી નંગ-૨ તથા સોનાની વીંટી નંગ-૧ મળી કુલે કિ.રૂ. ૧૧૨૦૦૦/- ના મત્તાનો મુદ્દામાલ મળી આવતા આરોપીની પુછપરછ કરતા તેણે અને તેનો મોટો ભાઇ જગદીશ સીકલીકર નાઓએ મળીને સદર સોનાના દાગીના ભટાર રવિદર્શન સોસાયટી મકાન નં. બી/૩૯ માં તિજોરીના ખાનાની ડુપ્લીકેટ ચાવી બનાવવાના બહાને મકાનમાં પ્રવેશ કરી મકાન માલીકની નજર ચુકવીને તિજોરીમાંથી દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કરતા આ બાબતે ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૨૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦,૧૧૪ મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે. સદર ગુન્હાની હકીકત એવી રીતેની છે કે, આ ગુનાના ફરીયાદીશ્રી પ્રફુલભાઇ બાબુભાઇ પટેલ ઉ.વ. ૬૫ રહે, બી/૩૯, રવિદર્શન સોસાયટી, ભટાર ચાર રસ્તા નાઓના મકાનમાં તા.૧૩/૦૧/૨૦૨૦ ના રોજ કલાક ૧૫/૧૫ થી કલાક ૧૭/૦૦ વાગ્યા દરમ્યાન સરદારજી જેવા દેખાતા બે ઇસમોએ તિજોરીના ખાનાની ચાવી બનાવવા માટે આવી ચાવી બનાવી આપવાના બહાને તિજોરીમાંથી સોનાની બંગડી નંગ-૨, સોનાની લગડી નંગ-૧ સોનાની વીંટી નંગ-૨ અને રોકડા રૂપિયા-૧૬૦૦૦/- મળી કુલ રૂ.૧૬૦૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ નાસી ગયેલ હતા. દરમ્યાન ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ માણસોને આરોપી સોનાના દાગીના વેચવા માટે આવવાનો હોવાની મળેલ બાતમી હકીકત આધારે વોચમાં રહી પકડી પાડી, પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.